

કલમ ૪(૧)(બી)(૨)મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલના અધિકારી/કર્મચારીઓની સત્તા અને ફરજો:

૧.સીની. સ્થાનિક વૈ. અમલદારશ્રી :-

ડે.કમિશનરશ્રી(હેલ્થ અને હોસ્પિ.) તથા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન અને હુકમ તેમજ સામાન્ય સભાએ મંજૂર કરેલ વિનયમો પ્રમાણે અતિ આવશ્યક તબીબી સેવાઓ, તાકીદની સેવાઓ સામાન્ય સેવાઓ તેમજ હોસ્પિટલની સુવ્યવસ્થા તેઓશ્રીના સીધા નિયંત્રણ અને માર્ગદર્શન પ્રમાણે ચાલે છે.

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં પેરામેડીકલ સ્ટાફ, વહીવટી સ્ટાફ જેવા કે, મેડીકલ ઓફિસરો, નર્સો, ક્લાર્ક કમ કમ્પા. આસી., લેબોરેટરી ટેકનીશ્યનો, ડાયાલીસીસ ટેકનીશ્યનો, એક્સ-રે ટેકનીશ્યનો, મુકાદમ, આયા, વોર્ડબોય, સફાઈ કામદારો, સેક્શન ઓફિસર, હેડ ક્લાર્ક, સીની.ક્લાર્ક વિગેરે તેઓની દેખરેખ હેઠળ ફરજ બજાવે છે. લેબર લોઝના કેસો તેમજ મેડીકલ લીગલ કેસ સહિતના તમામ હોસ્પિટલ રેકર્ડની વ્યવસ્થિત જાળવણી અને મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતેના મેડીકલ સ્ટોર્સ સીધી દેખરેખ હેઠળ છે. આર.ટી.આઈ.ના કેસોમાં અપીલ અધિકારી તરીકે જરૂરી કામગીરી બજાવવી તેમજ હોસ્પિટલને સંલગ્ન તમામ બાબતોની વેબસાઈટ પર જરૂરી ડેટા અપડેટ કરાવી તેની પર દેખરેખ રાખવી હોસ્પિટલનું જરૂરી સ્ટેટીકસ્ટીકસ નિભાવી તેમાંથી જરૂરી ડેટાઓ નિયમિતપણે સંબંધિત ખાતાને મોકલવા, કોર્પોરેશનના અન્ય ખાતામાંથી માંગવામાં આવેલી માહિતી એપ્રુવ કરાવી લાગત ખાતાને મોકલવી. બાયોમેડીકલ વેસ્ટને લાગત તમામ પ્રકારની કામગીરી તેમજ હોસ્પિટલને લગતી તમામ પ્રકારની કામગીરી ઉપર સીધી દેખરેખ રાખે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય બાબતોમાં પણ એ હોસ્પિટલના નોડલ ઓફિસર તરીકે કામગીરી બજાવે છે. ઉપરાંત હોસ્પિટલના વડા અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૨. માનદ્વ તબીબો :-

સીની. સ્થાનિક વૈ. અમલદારશ્રીના સીધા માર્ગદર્શન અને હુકમ પ્રમાણે મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલમાં કુલ-૨૭ માનદ્વ તબીબો, દર અઠવાડીયે તેઓના નિર્ધારિત સમયે ઓ.પી.ડી.માં અને ઈમરજન્સીમાં સેવા આપે છે. માનદ્વ સર્જનો દ્વારા દર્દીના રોગના લક્ષણો પ્રમાણે જરૂરી સર્જરી હોસ્પિટલમાં કરવામાં આવે છે.

૩. પેથોલોજીસ્ટ :-

રોગ પરિક્ષણ માટે આવતા દર્દીઓનાં બ્લડ યુરીન વિગેરેની વિવિધ તપાસ લેબોરેટરી ટેકનીશ્યનો દ્વારા કરાવી, રીપોર્ટ તૈયાર કરાવવા તેમજ જુદા જુદા મશીનોની સાચવણી કરવી અને તે માટે જરૂરી AMC , CMC આપવા અંગેના રીપોર્ટ તથા જરૂરી રીએજન્ટો મંગાવવાના રીપોર્ટ વિગેરે ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૪. મેડીકલ ઓફિસરો :-

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરો જુદા જુદા વોર્ડમાં શીફ્ટવાઈઝ ફરજો બજાવે છે. તેઓની ફરજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જોઈ તપાસી તેમજ માનદ્વ તજજ્ઞ દ્વારા પ્રિસ્ક્રાઈબ્ડ કરેલ સારવાર આપવાની છે. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરો દર્દીઓને જોઈ તપાસી રોગ, લક્ષણો મુજબ જરૂરિયાત પ્રમાણેની દવાઓ લખી જરૂરી સારવાર આપવામાં આવે છે, જરૂર જણાય તો મેડીકલ સાઈડના કેસો એટલે કે ડાયાબીટીસ, બ્લડપ્રેશર, હાર્ટની બિમારી વિગેરે અંગે હોસ્પિટલમાં દરરોજ આવતા જુદા જુદા માનદ્વ ફિઝીશ્યનોને બતાવી/તપાસાવી તેમની સલાહ મુજબની જરૂરી દવાઓ લેવાનું સુચન કરે છે અને સર્જરી સાઈડના રોગો મેડીકલ ઓફિસરોને દર્દીની તપાસમાં માલમ પડે તો હોસ્પિટલમાં આવતા માનદ્વ સર્જનોને બતાવી દવા લેવાનું સુચન કરવામાં આવે છે. જે વિભાગના ડોક્ટરો અત્રે નથી તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે જવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૫. એક્સ-રે ટેકનીશ્યન :-

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ડીજીટલ એક્સ-રે મશીન ઉપલબ્ધ છે. એક્સ-રે ટેકનીશ્યનો દર્દીઓના એક્સ-રે પાડી આપે છે. જે આધારે દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૬. પેરામેડીકલ સ્ટાફ :-

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સો, લેબોરેટરી ટેકનીશ્યનો, એક્સ-રે ટેકનીશ્યનો, ડાયાલીસીસ ટેકનીશ્યનો તેઓને આનુસાંગિક સેવાઓ જેવી કે,

(અ) નર્સો :

હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને સારસંભાળ રાખવાની ફરજ બજાવે તેમજ જુની. મેડીકલ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ ઈન્જેક્શન, દવા, ગ્લુકોઝ ચઢાવવા જેવી કામગીરી કરે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(બ) લેબોરેટરી ટેકનીશ્યન :

રોગ પરિક્ષણ માટે આવતા દર્દીઓનાં બ્લડ યુરીન વિગેરેની વિવિધ તપાસ કરી હોસ્પિટલ ખાતે ફુલટાઈમ પેથોલોજીસ્ટના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ રીપોર્ટ તૈયાર કરે છે. જે અન્વયે દર્દીને સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(ક) ડાયાલીસીસ ટેકનીશ્યન :

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ૦૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ છે. અત્રે ૦૨ ડાયાલીસીસ ટેકનીશ્યન ફરજ બજાવે છે. જેઓ દર્દીઓને ડાયાલીસીસની જરૂરી સારવાર આપવાની ફરજ બજાવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(ડ) ક્લાર્ક કમ કમ્પા. આસી. :

દર્દીઓને જોઈ તપાસી લખી આપેલ જરૂરી દવાઓ માંથી મસ્કતિ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાઓ દર્દીઓને આપવી તેમજ દવાના પ્રિસ્ક્રીપ્શનો લખી આપવા. મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીકલ સ્ટોરના દવાના બીલો પ્રિસ્ક્રીપ્શન મુજબ છે કે કેમ તે ચેક કરવા. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(ઈ) સેનેટરી સબ ઈન્સ્પેક્ટર :

પોતાની ફરજ દરમિયાન મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તમામ સફાઈ કામદારોની હાજરી પુરવી, રૂદરપુરા હેલ્થ કેમ્પથી ફુલઝાડુ, બુતારા, પ્લાસ્ટીકની બેગ જેવી સાધન સામગ્રી લાવવી વખતો વખત રજીસ્ટર મેઈન્ટેઈન કરવું તેમજ હોસ્પિટલનો તમામ પ્રકારનો બાયોમેડીકલ વેસ્ટ ડિસ્પોઝલના નિયમોમાં દર્શાવ્યા પ્રમાણે નિકાલ કરવો. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(ફ) મુકાદમ :

સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ધ્વારા સફાઈ કામદારોને સોપવામાં આવેલ કામગીરીનું નિરીક્ષણ કરવું. તેમજ તમામ વોર્ડમાં દરેક પાળીમાં તેઓની ગોઠવણ કરવી. પોતાની સીધી દેખરેખ હેઠળ સફાઈ કામદારો પાસે હોસ્પિટલના દરેક વિભાગોની સફાઈ અંગેની કામગીરી કરાવવાની હોય છે. તથા સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની સુચના મુજબ કામગીરી કરવી.

(ગ) વોર્ડબોય અને આયા :

ઓ.પી.ડી.ની સાફ-સફાઈ, ઓ.પી.ડી. કેસની નોંધણી, ઓ.પી.ડી.માં પેશન્ટને લાગત ચીજ વસ્તુઓ પુરી પાડવી, જરૂર પડ્યે પેશન્ટને એક્ષ-રે, લોહી ચકાસણી અર્થે લઈ જવા, દર્દીને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવું, ઓ.પી.ડી.નો સમય પુરો થયેથી પંખા, લાઈટો, બારી બારણા બંધ કરવા અને

દર્દીઓની માહિતી ટેલીફોન કાઉન્ટર પર પહોંચતી કરવી. વોર્ડમાં ડસ્ટીંગ, દવા છાંટવી, કેસપેપર બનાવવા, ડ્રેસીંગ મટીરીયલ્સ કાપવું, ફ્રીઝ-કબાટો સાફ કરવા, લીનન ગણવા, બાયોમેડીકલ વેસ્ટ જમા કરવો, પેશન્ટને શીફ્ટ કરવા, નવા દાખલ થનાર દર્દીને સારવાર આપવામાં નર્સ તેમજ ડોક્ટરને મદદ કરવી, ઓટોકલેવ માટે ટ્રે અને ડ્રમ મુકવા, ઓક્સિજનના ખાલી બાટલા ભરાવવા, સ્ટેશનરી લેવા જવું, ઉપરાંત વોર્ડમાં નર્સને મદદ કરવી. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(હ) સફાઈ કામદાર/બેલદાર :-

મુકાદમની સીધી દેખરેખ હેઠળ સફાઈ કામદારો શીફ્ટવાઈઝ વોર્ડમાં ફરજ બજાવે છે. આ દરમિયાન દર્દીઓને લાવવા લઈ જવા, દર્દીની પથારી વિગેરે વ્યવસ્થિત કરવા તેમજ વોર્ડ, હોસ્પિટલની સાફ સફાઈ અંગેની કામગીરીની ફરજ બજાવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૭. વહીવટી વિભાગ :-

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલના સંચાલન માટે વહીવટી વિભાગમાં ડે.એકાઉન્ટન્ટ, સેક્શન ઓફિસર, આસી.એકાઉન્ટન્ટ, હેડક્લાર્ક, સીની.ક્લાર્ક, ત્રીજીશ્રેણી ક્લાર્ક તેમજ પટાવાળાનો સ્ટાફ કાર્યરત છે.

૧.૩.એકાઉન્ટન્ટ :-

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ના બીલોની ચકાસણી તેમજ હિસાબી તથા ઓડિટ ખાતાને લાગત તમામ કામગીરી પર દેખરેખ રાખવી.

૨.સેક્શન ઓફિસર :-

હોસ્પિટલનો સામાન્ય વહીવટ સુવ્યવસ્થિત અને સુચારુ ચાલે તે માટે, મહેકમની કામગીરી ઉપર દેખરેખ, તાબા હેઠળનાં કર્મચારીઓની રજા મંજૂર કરવી, વહીવટી સ્ટાફમાંથી કર્મચારી રજા ઉપર હોય ત્યારે તેમની જગ્યાએ અન્ય કર્મચારીની ગોઠવણી કરવી.ઓફિસ કામો કરાવવા અન્ય ખાતા/ ઝોનમાં રીપોર્ટ કરાવવા.હોસ્પિટલના તમામ કર્મચારીના ઈન્ક્રીમેન્ટ, રજા વિગેરે નિયમિત રીતે પાસ થાય તેની પર દેખરેખ સ્ટેશનરી, સેનેટરી સામાન માટે ઈન્ડેન્ટ ઓથોરીટી તરીકે તમામ ઈન્ડેન્ટ પર સહી કરવી. તાબા હેઠળના કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખવી.ભરણું ચેક કરવું . હોસ્પિટલમાં આવતા પેમેન્ટના તમામ બીલો ચેક કરવા, હોસ્પિટલના તમામ રેકર્ડની વર્ગીકરણ મુજબ જાળવણી કરાવવી અને રેકર્ડ નિયમિત રીતે રેકર્ડ ખાતામાં જમા કરાવવા, ડેડસ્ટોક રજીસ્ટર નિભાવવા સમયાંતરે કંડમ માલસામાન/રેકર્ડ/સાધનોનાં નિકાલની કામગીરી સ્ટાફ પાસે કરાવવી તેમજ હોસ્પિટલના નિભાવ/મરામતની લગતી ફરીયાદોનો લાગત અધિકારીને ધ્યાને લાવી નિકાલ કરી તેનો રેકર્ડ નિભાવવો, તેમના તાબા હેઠળના કર્મચારીને મેમો, કારણદર્શક નોટીસ, ચાર્જશીટ વિગેરે તૈયાર કરવાનું કામ બી.પી.એમ.સી. એક્ટના ૭૩(ડી) અને ચેપ્ટર ૫(૨)૨ હેઠળની દરખાસ્તો તૈયાર કરાવવી, ઉપરાંત હોસ્પિટલના વડા અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૩. આસી.એકાઉન્ટન્ટ :-

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ના બીલોની ચકાસણી તેમજ હિસાબી તથા ઓડિટ ખાતાને લાગત તમામ કામગીરી પર દેખરેખ રાખવી.

૪. હેડ લાર્ક :-

હોસ્પિટલનો સામાન્ય વહીવટ સુવ્યવસ્થિત અને સુચારુ ચાલે તે માટે, સેક્શન ઓફિસરની ગેરહાજરીમાં તેઓની તમામ ફરજ ઉપરાંત, પર્સનલ એડવાન્સનું રજીસ્ટર નિભાવવું . પાર્ટીની ઈ.એમ.ડી./સીક્યોરીટી ડીપોઝીટ સમય મર્યાદામાં છુટી કરવી. હોસ્પિટલમાં ભાડે આપવામાં આવેલ મેડીકલ સ્ટોરની તમામ આનુસંગિક કાર્યવાહી કરવી. વેપારી બીલોના પેમેન્ટ અંગેની કાર્યવાહી કરવી.હોસ્પિટલના તમામ સાધનોના મેઈન્ટેનન્સ, મરામત નિભાવની અને ખરીદેલ સાધનોની ડેડસ્ટોક રજીસ્ટર અને વપરાશી વસ્તુનું રજીસ્ટર નિભાવવું. ટેન્ડર ઈ.એમ.ડી./એસ.ડી.ને લગતી ઓડિટ ઓબ્જેક્શનની કામગીરી કરવી. જુના કન્ડમ થયેલ સાધનની ડિસ્પોઝ કરવાની કાર્યવાહી સેક્શન ઓફિસર સાથે સંકલનમાં રહીને કરવી.

૫. બીજી શ્રેણી કલાર્ક :-

એસ્ટાબ્લીશમેન્ટ એટલે કે, મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓના પગાર, રજા, પેન્શન, રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ-૨૦૦૫ હેઠળ મળતી તમામ અરજી પરત્વે સમય મર્યાદામાં માહિતી / પ્રત્યુત્તર આપવાની કામગીરી તેમજ તે અંગેનું રજીસ્ટર મેઈન્ટેઈન કરવા, દર માસે સ્ટાફના માસ્ટર ડેટા, લીવ ડેટા, એડજસ્ટમેન્ટ ડેટા તેમજ વિવિધ પ્રકારના નાણાકીય તફાવતની ગણતરી કરવી, એલ.ટી.સી.ની ચકાસણી કરવી, હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા માનદ્વ ડોક્ટરોના બીલ બનાવી દર માસે નાણા ચુકવવાની કાર્યવાહી, હોસ્પિટલને લાગત સાધન સામગ્રી ખરીદવા અંગેના ટેન્ડર/ક્વોટેશનની તમામ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી. બજેટ અંગેની કાર્યવાહીમાં મદદ કરવી. હિસાબીખાતા તેમજ ઓડિટખાતાના સંકલનમાં રહી કર્મચારીઓની સેવાપોથી અંગેની તમામ કાર્યવાહી. સસ્પેન્ડ થયાની કામગીરી.

૬. ત્રીજી શ્રેણી કલાર્ક :-

ઈનવર્ડ/આઉટવર્ડ રજીસ્ટર અપડેટ રાખવા, જુદા જુદા પરિપત્રો ઠરાવો વગેરેની ફાઈલ તૈયાર કરવી. કોમ્પ્યુટરને લગતી કામગીરી, કેસ કાઢવા, જુના કેસ કાઢવા, હોસ્પિટલના બીલોની વસુલાત કરવી, ભરણા કરવા અંગેની કામગીરી કરે છે. વિવિધ દર્દીઓને આપવામાં આવેલ બીલ રાહતો બાબત એક્ટની કલમ ૭૩(ડી) હેઠળની દરખાસ્તો સેક્શન ઓફિસરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવા વિગેરે કામગીરી નિભાવે છે.